

Seat No. : _____

ZC-112

April-2014

B.A., Sem.-IV

CC-212 : Home Science

(Women Empowerment & Entrepreneurship)

Time : 3 Hours]

[Max. Marks : 70

1. વ્યક્તિની વ્યાખ્યા જણાવી, તેને અસર કરતા પરિબલો જણાવો. 14
Define Personality & discuss the factors influencing it.
અથવા/OR
ટૂંકનોંધ લખો :
Write short notes on :
(i) સ્ટ્રેસ દૂર કરવાનાં રસ્તા જણાવો.
Explain the ways of coping up stress.
(ii) જક્કી વલણ
Stubborn behaviour
2. યોગાસન વિષે સંપૂર્ણ માહિતી આપો. 14
Give detailed information about Yogasana.
અથવા/OR
ટૂંકનોંધ લખો :
Write short notes on :
(i) બ્યુટી ટ્રીટમેન્ટની જરૂરીયાત જણાવો.
The importance of beauty treatment
(ii) વ્યાયામથી થતાં ફાયદા જણાવો.
Advantages of Exercise
3. સ્ત્રી-સશક્તિકરણ માટે માહિતી-પ્રાપ્તિનાં સ્થાન જણાવો. 14
Sources of information for Women Empowerment.
અથવા/OR
ટૂંકનોંધ લખો :
Write short notes on :
(i) ગૃહવિજ્ઞાન શિક્ષણ
Home Science Education
(ii) સ્ત્રીઓની કારકિર્દીને નડતા અવરોધો જણાવો.
Hurdles in building carrier of woman.
4. નવા ઉદ્યોગો શરૂ કરવાનાં તબક્કા જણાવો. 14
Steps for starting business / industry.
અથવા/OR

ટૂંકનોંધ લખો :

Write short notes on :

- (i) વેલ્યુ એડેડ ટેક્સ એટલે શું ?
What is value added tax ?
- (ii) નાના કદનાં ઉદ્યોગો
Small scale industries

5. (A) જોડકાં જોડો : 'A' સાથે 'B'
Match 'A' with 'B' :

7

A	B
1. ભોજનનાં પ્રકાર Types of meal	a. ગુના તરફ વળે Turn to crime
2. ચામડીનાં પ્રકાર Types of Skin	b. પર્સનાલીટી / મહોરૂ Personality / Mask
3. સૌથી ઉત્તમ આસન Best in all Yogasan	c. યોગ્ય આહાર જરૂરી Perfect food is necessary
4. જક્કીવલણ, સ્ટ્રેસ Stubborn, stress	d. રૂક્ષ-તૈલી-સામાન્ય Dry, oily, normal
5. 'પર્સોના' 'Persona'	e. માનસિક સારવાર Psychological treatment
6. કસરત Exercise	f. રાજસી-તામસી-સાત્વીક Rajsi, Tamsi, Satvic
7. અહૂમ ઘવાતાં Ego hurt	g. સૂર્ય નમસ્કાર Surya Namaskaar

- (B) એક વાક્યમાં જવાબ આપો :

7

Answer in **one** sentence :

- (1) વાળનાં પ્રકારનાં નામ આપો.
Name the types of hair.
- (2) વ્યક્તિત્વ માટે અગત્યની બે ગ્રંથિઓનું સમતોલન.
State the two balance complexes which effect personality.
- (3) માનસિક તાણ ઘટાડવાનો ઉત્તમ રસ્તો દર્શાવો.
The best way to reduce stress.
- (4) અંધશ્રદ્ધા દૂર કરવાનો સૌથી અગત્યનો રસ્તો.
The best way to reduce wrong believes.
- (5) આવકવેરો ક્યારે ભરવો પડે ?
When should income-tax be paid ?
- (6) લઘુઉદ્યોગની સ્થાપના માટે મદદકર્તા સંસ્થાનાં માત્ર નામ આપો.
Name the institution helps small scale industries.
- (7) સ્વ-વિકાસ માટે અગત્યનાં પરિબળો.
Factors develop one's own self.